



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૬/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૫૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૮ કેસ કરી, ૭૧ વ્યક્તિઓને ઝડપી, ૬૯૩ લીટર દેશી દારૂ, ૨૭૬ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૫ ક્વોટર ઇંગ્લીશ દારૂ, ૫૮૧ બીયરટીન, ૦૧ સ્કુટર અને ૦૨ ઓટોરીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૧૦ કેસ કરી ૨૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૫,૯૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૫૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓ અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૯૫૬/૧૯

**સોલા હાઇકોર્ટ :** સંજયભાઈ પુનમભાઈ પટેલ (રહે.સોમેશ્વર ટેનામેન્ટ અંબિકાકૃપા બસ સ્ટેન્ડ રાણીપ) એ તા.૦૩/૦૬/૨૦૧૯ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૧૦/૨૦૧૮ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી રોનકભાઈ નટવરલાલ પટેલ (રહે. સોમેશ્વર ટેનામેન્ટ એ.એમ.ટી.એસ બસ સ્ટોપ પાસે થલતેજ) એ સંજયભાઈ પાસેથી ભાડે થી સ્વીફ્ટ કાર નંબર GJ-01-DX-5499 કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- તથા ઇનોવા કાર નંબર GJ-01-DV-0132 કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦/- મતાની એમ કુલ બે કાર ભાડેથી કરાર મુજબ ચલાવી ભાડુ ચુકવવાનો વિશ્વાસ અને ભરોસો આપી ગાડીઓ મેળવી લઈ, ભાડા પર લીધેલ કાર ત્રાહિત વ્યક્તિને ગીરવે આપી નાણાકીય લાભ મેળવી આજદિન સુધી કાર પરત નહિ આપી સંજયભાઈ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.કે.મકવાણા ચલાવે છે.

**સોલા હાઇકોર્ટ :** ગંગારામ પ્રભુદાસભાઈ પટેલ (ઉ.વ.૬૫)(રહે.ગૌરવ બંજ્લોઝ ગુલાબ ટાવર પાસે સોલા) એ તા.૦૩/૦૬/૨૦૧૯ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૬/૨૦૧૧ થી તા.૧૮/૨/૨૦૧૫ સુધીના સમયગાળા દરમ્યાન મંગલમ નિર્વાણ સાયન્સ સીટી રોડ સોલા ખાતે આરોપી નવીનભાઈ મંગળદાસ પટેલ (રહે.સંઘ્યા કો.ઓ.હા. સો.લી ઇશ્વરભુવનની પાછળ નવરંગપુરા) તથા સંજયભાઈ મંગળદાસ પટેલ (જેના સરનામાની ખબર નથી) એ ભેગામળી “મંગલમ ઇન્ફ્રાકોન ગુજરાત પ્રાઇવેટ લિમીટેડ” કંપનીની સ્કીમના આવેલ સી/૦૦૨ ફ્લેટ પેટે અલગ-અલગ ચેક દ્વારા કુલ રૂપિયા ૪૬,૫૦,૦૦૦/- ચુકવેલ હોવા છતાં, ખોટો એલોટમેન્ટ લેટર અને દસ્તાવેજ બનાવી આપી ગંગારામની માલીકીનો ફ્લેટ બીજી વ્યક્તિને વેચાણ આપી ગંગારામ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

માધવપુરા : મમતાબેન વા/ઓ જેકી કરમચંદ દેવાણી (ઉ.વ.૨૬)(રહે.ઓઝોન સીટી, આઇ.ટી.આઇ રોડ રાધસ્વામી પાર્ક સોસાઇટી ની સામે કુબેરનગર) તા.૦૨/૬/૧૯ રાતના ૧૧/૨૦ વાગ્યાના સુમારે મુસાસુહા કબ્રસ્તાનથી થોડાક આગળ અમીર મોટર્સ નામની દુકાન સામે રોડ ઉપર પતિ સાથે એક્ટિવિવા પાછળ બેસી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક એક્ટીવાનો ચાલક (૨૦ થી ૨૫ વર્ષના આશરાનો) મમતાબેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- મતાનો ખેંચી તોડી લઇ નાસી ગયો છે. આ અંગેની ફરીયાદ મમતાબેન દેવાણી એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

સેટેલાઇટ : આશીષભાઇ અશોકભાઇ કારાવદર (ઉ.વ.૨૫)(રહે.શુભદર્શન એપાર્ટમેન્ટ પ્રેરણાતિર્થ દેરાસરની બાજુમા જોધપુર સેટેલાઇટ) તા.૦૩/૦૬/૨૦૧૯ ના કલાક ૬/૧૫ વાગ્યાના સુમારે નારાયણ ગુરુ સ્કુલની સામે રામદેવનગર એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ આગળ રોડ ઉપર થી પસાર થતા હતા દરમ્યાન એક પલ્સર મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) ભેગામળી આશીષભાઇના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૮,૦૦૦/- મતાની ખેંચી તોડી લઇ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ આશીષભાઇ કારાવદર એ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.ગમારા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૯૫૮/૧૯

સેટેલાઇટ : શાહીન ફારુકભાઇ મંદોસરવાલા (ઉ.વ.૨૭)(રહે.કૈકૈશા ફ્લેટ મ્યુનીસીપલ હોસ્પિટલ પાસે દાણીલીમડા) એ તા.૩/૬/૧૯ નારોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૫/૨૦૧૯ સાંજના ૦૬/૦૦ થી ૦૬/૩૦ વાગ્યા દરમ્યાન સેટેલાઇટ ઇસ્કોન મંદીરની પાછળ, પ્રીવીલોન બીલ્ડીંગ ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન નંબર-૧૪ માં “રિતુ કુમાર” રેડીમેટ કપડાના શો રૂમમાં બે અજાણી સ્ત્રીઓ ગ્રાહક તરીકે પ્રવેશ કરી, શો-રૂમની અંદર ડીસ્પલે માં મુકેલ સીલ્ક સાડી નંગ-૨ કિંમત રૂપિયા ૧,૬૦,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.બી.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૫૯/૧૯

શહેરકોટડા : ગોસીયાબાનુ વા/ઓ મોહમ્મદનિયાઝ પઠાણ(રહે.જાલમપુરી ની ચાલી, સરસપુર) એ કોઇ અગમ્ય કારણસર તા.૦૩/૦૬/૨૦૧૯ બપોરના ૩/૩૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે લોખંડની પાઇપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી આર.જે.કલાસવા ચલાવે છે.

રામોલ : વસીમભાઈ લાલાભાઈ મનસુરી (ઉ.વ.૩૨)(રહે.જનતાનગર રામોલ) એ કોઈ અગમ્ય કારણસર તા.૦૩/૦૬/૨૦૧૯ ના કલાક ૦૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રાધાબેન ચંદુભાઈ ચલાવે છે.

ઇસનપુર : ફિરોજ હસુમિયા શેખ (ઉ.વ.૩૦)(રહે.એ-વન પાર્ટી પ્લોટની પાસે ચંડોળાના છાપરા ઇસનપુર) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૬/૨૦૧૯ ના કલાક ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે નાહવાના રૂમલને રૂમની છત ઉપર આવેલ લોખંડની પાઇપ સાથે બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.ચાવડા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.